



HCP-001-001597

Seat No. _____

B. A. (Sem. V) (CBCS) Examination

October – 2017

Geography : Paper - XIV

(Environmental Geography)

(New Course)

Faculty Code : 001

Subject Code : 001597

Time : 2½ Hours]

[Total Marks : 70

- સૂચના :** (૧) બધા પ્રશ્નો ફરજિયાત છે.
(૨) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો.

- ૧ પર્યાવરણ ભૂગોળનો અર્થ સમજાવી, તેના કાર્યક્ષેત્રની વિગતે ચર્ચા કરો. ૧૪
અથવા
- ૧ પારિસ્થિતિક તંત્ર એટલે શું ? તેના પ્રકારો વિગતે વર્ણવો. ૧૪
- ૨ કુદરતી આફતોના પ્રકારો જણાવી, કોઈ પણ એકનું વિગતે વર્ણન કરો. ૧૪
અથવા
- ૨ માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોની વિગતે ચર્ચા કરો. ૧૪
- ૩ વાયુ પ્રદૂષણના સ્ત્રોત કયા છે ? માનવ સર્જિત વાયુ પ્રદૂષણ વિશે વિગતે માહિતી આપો. ૧૪
અથવા
- ૩ માનવ અને પર્યાવરણના સંદર્ભમાં પ્રકૃતિ-પ્રભાવવાદ વિગતે સમજાવો. ૧૪
- ૪ આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ના પદ્ધતિસરનાં કાર્યોની વિગતે સમજૂતી આપો. ૧૪
અથવા
- ૪ પર્યાવરણીય શિક્ષા અને જાગૃતિનું મહત્ત્વ સમજાવી, ભારતમાં પર્યાવરણ બચાવના મુખ્ય લોક આંદોલનની ચર્ચા કરો. ૧૪
- ૫ નીચેનામાંથી કોઈ પણ બે પર નોંધ લખો : ૧૪
(૧) પર્યાવરણના પ્રકારો
(૨) સંભવવાદ
(૩) જળ પ્રદૂષણના સ્ત્રોત
(૪) માનવ પ્રવૃત્તિઓના દ્વારા પર્યાવરણની અવનતિ.

ENGLISH VERSION

- Instructions :** (1) All questions are compulsory.
(2) Draw neat diagram wherever necessary.

1 Explain the meaning of environment geography and discuss in detail the scope of its. 14

OR

1 What is Eco-system ? Describe its types in detail. 14

2 State the types of natural hazards and describe in detail any one of them. 14

OR

2 Discuss in detail the relationship between man and environment. 14

3 What are the sources of Air pollution ? Give detailed information of Air pollution made by human. 14

OR

3 Explain in detail the determinism with special reference to Man and environment. 14

4 Explain in detail systematic functions of disaster management. 14

OR

4 Explain the importance of environmental education and awareness. Discuss the main public movement to save environment in India. 14

5 Write notes on any **two** of the following : 14

(1) Types of environment

(2) Possibilism

(3) Sources of water pollution

(4) Degradation of environment by human activities.